

● કેલની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ ●

મૂળભૂત માહિતી:

અંગ્રેજી નામ: Kale

વાનસ્પતિક નામ: Brassica oleracea var. acephala

ઉદ્ભવસ્થાન: ચુરોપ, એશિયા માર્ડિનર

ખાદ્ય ભાગ: પાન, પ્રક્રિયા

અન્ય નામ : Leaf cabbage (પાંદડાવાળુ કોબીજ), Cabbage's cousin (કોબીજની પિતરાઈ)

કેલ એ હંડી અડતુંનો લીલા પાંદડા વાળો શાકભાજુ પાક છે, જે કોબીજ પરિવારનો સભ્ય છે. તે વિશ્વભરમાં સૌથી વધુ લોકપ્રિય અને પૌષ્ટિક શાકભાજુમાંની એક છે. ભારતમાં તેની લોકપ્રિયતા તેમજ હોટલોમાં માંગ દિવસે ને દિવસે વધી રહી છે. કેલની ખેતી ઉત્તર ભારતના અનુકૂળ કૃષ્ણ-આબોહવાના પરિસ્થિતિઓ ધરાવતા બહુ ઓછા વિસ્તારો જેવા કે હિમાચલ પ્રેદેશ, ઉત્તર પ્રદેશ, જમ્�μ, કાશ્મીર, પંજાબ, હરિયાણા અને નીલગીરીની ટેકરીઓ માટે ઓગસ્ટ થી સપ્ટેમ્બર મહિનાઓને વાવણીનો સમય ગણવામાં આવે છે. જ્યારે હિમાચલ પ્રેદેશ, જમ્�μ, કાશ્મીર અને નીલગીરીની ટેકરીઓ માટે ઓગસ્ટ થી સપ્ટેમ્બર મહિનાઓ વાવણી માટે અનુકૂળ છે. ગુજરાતમાં કેલ મુખ્યત્વે રવિ પાક તરિકે ઉછેરવામાં આવે છે અને ૧૫ ઓક્ટોબર થી ૧૫ નવેમ્બર સમયગાળાની વાવણી આર્દ્ધ નીવડી શકે છે.

પોષણ મૂલ્ય (પ્રતિ ૧૦૦ ગ્રામ તાજા લીલા પાનના વજન પ્રમાણે):

ભિન્ન	૩૫ કિલોકેલસી	વિટામિન - સી	૬૩.૪ મિલિગ્રામ	ફોલ્કરસ	૫૫ મિલિગ્રામ
કાર્બોહાઇડ્રેટ	૪.૪૨ ગ્રામ	વિટામિન - ઈ	૦.૯૯ મિલિગ્રામ	પોટેશિયમ	૩૪૮ મિલિગ્રામ
પ્રોટીન	૨.૬૨ ગ્રામ	વિટામિન - કે	૩૮૮.૯ માઈકોગ્રામ	સોડિયમ	૫૩ મિલિગ્રામ
શેખા	૪.૧ ગ્રામ	કેલ્લિયમ	૨૪૪ મિલિગ્રામ	ઝીંક	૦.૩૮ મિલિગ્રામ
વિટામિન - એ	૪૮૧૨ આઈ.સુ.	આર્થરન	૧.૬ મિલિગ્રામ	કોપર	૦.૦૫૩ મિલિગ્રામ
વિટામિન - બી ડ	૦.૧૪૭ મિલિગ્રામ	મેનેનિયમ	૩૨.૭ મિલિગ્રામ	મેનોનીજ	૦.૮૨ મિલિગ્રામ

સ્રોત: <https://fdc.nal.usda.gov>

આબોહવા :

કેલ એ ૧૦° સે. થી ૧૫° સે. સુધીની હંડીનો સામનો કરી શકે એવો પાક છે. મૂળભૂત રીતે, આ પાંદડા વાળા શાકભાજુ પાકને શીત પ્રેદેશની આબોહવા અનુકૂળ આવે છે તેથી હંડા વિસ્તારોમાં તેમજ શિયાળાના સમયગાળા દરમિયાન તેની ખેતી સારી રીતે કરી શકાય છે.

જમીન:

કેલને સારા એવા પ્રમાણમાં સેંદ્રિય તત્વો ધરાવતી તથા સાથે સાથે યોગ્ય પાણીના નિકાલવાળી, રેતાળ, પોચી, ભરભરી જમીન ખૂબ જ માફક આવે છે. આ પાકને સારી નિતાર શક્તિ ધરાવતી જૂદી-જૂદી અનેક પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે. આ પાક જમીનમાં ક્ષારને સહન કરી શકે છે, તેમજ તેને ૫.૫ થી ૬.૫ પી. એચ. ધરાવતી જમીન ખૂબ જ અનુકૂળ આવે છે.

કેલની જતો:

કેલ મુખ્યાંતે ગ્રાન્ટ પ્રકારની જતો ધરાવે છે. બટકી (૪૦ સે.મી.થી ઓછી ઊંચાઈ), મધ્યમ (૪૦ થી ૮૦ સે.મી. ઊંચાઈ) અને ઊંચી (૮૦ સે.મી. થી વધુ ઊંચાઈ). ઊંચી જતોમાં પાંદડાની લણણી વેહલી થાય છે, પરંતુ તેનું ઉત્પાદન ઓછું હોય છે. બટકા પ્રકારની મુખ્ય જતો ડવાઈ થીન, કર્સક્સોય, ડવાઈ મોસકલ્ડ, મોસકલ્ડ વગેરે છે. હેમબર્ગ માર્કેટ અને કરમ સાગ એ મંદ્યમ ઊંચાઈ

ધરાવતી જતો છે, જેમાં કરમ સાગ એ જમું અને કાશ્મીરમાં મોટા ભાગે ઉગાડવાનું આવતી લોકપ્રિય જતોમાંની એક છે. સાઈબેરીયન અને સ્કોટીશ શીતળ પ્રેદેશમાં ઉગાડવા માટેની શ્રેષ્ઠ અનુકૂળ જતો છે. આ ઉપરાંત સેન્ટ્રલ કેલ પુસા ક્રિડ (કે.ટી.કે. ક્રિડ) એ નવી બહાર પડેલી કેલની જત છે, જેનું સરેરાશ ઉત્પાદન ૩૫ ટન/હેક્ટાર જેટલું નોંધવામાં આવ્યું છે. આ જત ગુજરાતમાં વધુ લોકપ્રિય અને ખેડૂતો જ્ઞારા સ્વીકારાયેલ જત છે.

રોપણીનો સમય:

ઢંડુ, શુષ્ક વાતાવરણ કેલના પાક માટે ખૂબ જ ફાયદાકારક છે. ભારતમાં સમગ્ર શિયાળા દરમિયાન તેની ખેતી કરી શકાય છે, ખાસ કર્યોને ઓક્ટોબર અને નવેમ્બરમાં કેલના બીજ વાવણામાં આવે છે. સામાન્ય રીતે ઉત્તર ભારતીય પરિસ્થિતમાં ઓગસ્ટ થી ઓક્ટોબર મહિનાઓને સૌથી ઉત્તમ વાવણીનો સમય ગણવામાં આવે છે. જ્યારે હિમાચલ પ્રેદેશ, જમ્�μ, કાશ્મીર અને નીલગીરીની ટેકરીઓ માટે ઓગસ્ટ થી સપ્ટેમ્બર મહિનાઓ વાવણી માટે અનુકૂળ છે. ગુજરાતમાં કેલ મુખ્યત્વે રવિ પાક તરિકે ઉછેરવામાં આવે છે અને ૧૫ ઓક્ટોબર થી ૧૫ નવેમ્બર સમયગાળાની વાવણી આર્દ્ધ નીવડી શકે છે.

જમીનની તૈયારી:

જમીનને હળથી કે ટ્રેકટરથી ઊંડી ખેડ કરવી. ત્યારબાદ સારું કોછવાયેલું છાણિયું ખાતર/કોમ્પોસ્ટ ખાતર ૨૦ ટન/હેક્ટાર પ્રમાણે જમીનમાં નાંખી જો કાળી માટી હોય તો ડિસ્ક હેરોયો ટેકા બાંગી નાખવા અને જો ગોરાળુ જમીન હોય તો કલ્ટિટેટ કેરવાયું. આનાથી જમીનમાં નાખેલું છાણિયું ખાતર/કોમ્પોસ્ટ ખાતર જમીનમાં બરાબર ભેટવાશે ઉપરાંત જમીન પોચી અને ભરભરો બનશે. આ ઉપરાંત જમીનમાં ઉગોલું નીદણ પણ દૂર થશે જે એક વધારાનો ફાયદો છે.

વાવણી:

કેલની વાવણીના મુખ્યત્વે બે પ્રકાર છે. એક તો બીજ સીધા જમીનમાં વાવી શકાય અથવા ધરાવાડીયા/ટ્રેમાં વાવી ૪-૬ અથવાડી પણી પાંદડા દેખાવાનું શર થાય ત્યારબાદ જમીનમાં ફેરસોપણી કરી શકાય. એક હેક્ટાર જમીનમાં કેલની ખેતી માટે ૪૦૦-૫૦૦ ગ્રામનો બીજ દર પર્યાપ્ત છે. કેલની વાવણી કે ફેરસોપણી માટે ૪૫ સે.મી. x ૨૦ સે.મી. x ૩૦ સે.મી. વાવણી અંતર યોગ્ય છે. મોટા પાન ધરાવતી જતો માટે વાવણી અંતર વધુ રાખવું.



ટ્રેમાં તૈયાર કરેલ કેલનું ધરા



કેલનો પાક



લણણી કરેલ કેલના પાન

પિયત વ્યવસ્થા:

પ્રથમ પિયત ખેતરમાં કેલની વાવણી કે ફેરસોપણી પણી તરત જ આપવું. ત્યારબાદ ૧૦ થી ૧૨ દિવસોના અંતરે વાતાવરણ તથા જમીનની પ્રતિ પ્રમાણે જરૂરિયાત મુજબ પાણી આપવું.

સંકલિત ખાતર વ્યવસ્થા:

અનુ. નંબર	ખાતર	પ્રતિ હેક્ટર ખાતરનો દર	ખાતર આપવાનો સમય	પ્રતિ હેક્ટર ખાતરની જરૂરિયાત
૧	છાણિયું ખાતર/કોમ્પોસ્ટ ખાતર	૨૦ ટન	જમીન તૈયાર કરતી વખતે	૨૦ ટન કોહવાયેલું છાણિયું ખાતર/કોમ્પોસ્ટ ખાતર
૨	રાસાયનિક ખાતર ના.:ફો.:પો. (કિ.ગ્રा./હેક્ટર)	૧૦૦:૮૦:૭૦	ચાર હજામાં	૨૭૦ કિ.ગ્રા. યુરિયા, ૫૬૩ કિ.ગ્રા. સિંગાલ સુપર ફિસ્કેટ, ૧૦૦ કિ.ગ્રા. મયુરેટ ઓફ પોટાશ
		૨૫:૬૦:૭૦	રોપણી સમયે પાયામાં	૫૫ કિ.ગ્રા. યુરિયા, ૫૬૩ કિ.ગ્રા. સિંગાલ સુપર ફિસ્કેટ, ૧૦૦ કિ.ગ્રા. મયુરેટ ઓફ પોટાશ
		૨૫:૦૦:૦૦	પ્રથમ લણણી પછી	૫૫ કિ.ગ્રા. યુરિયા
		૨૫:૦૦:૦૦	બીજી લણણી પછી	૫૫ કિ.ગ્રા. યુરિયા
		૨૫:૦૦:૦૦	બીજી લણણી પછી	૫૫ કિ.ગ્રા. યુરિયા

નીદણ નિયંત્રણા:

કેલના પાકમાં વાવળીના બીજા જ દિવસે ભીની જમીનમાં પ્રીએમરજન્સ નિંદામણ નાશકનો છંટકાવ કરવામાં આવે તો મોટા ભાગના નિંદામણને નિયંત્રિત કરી શકાય છે. આ ઉપરાંત જરૂરિયાત મુજબ એક થી બે આંતરખેડ પણ કેલમાં સાંદુ પરિણામ આપી શકે છે.

સંકલિત રોગ અને જીવાત નિયંત્રણા:

એનેક્ષિડ, ફ્લો બીટલ, લાઇટ ફ્લાય અને કેટરપિલર એ કેલના પાકમાં જોવા મળતી મુખ્ય જીવાત છે. આ જીવાતોને નિયંત્રણમાં લાવવા માટે ખેતરને સ્થાય અને નીદણ મુક્ત રાખવું, દક્ષિણ ગુજરાતમાં આ પાકમાં અસ્યાર સુધી કોઈ ગંભીર રોગ જોવા મળેલ નથી, પરંતુ જો એવો કોઈ રોગનિષ્ટ છોડ દેખાય તો સંક્ષિપ્ત છિંડેને ખેતરસાંથી દૂર કરવો, પાકની ફેરબદલી કરવી તેમજ રોગમુક્ત હિયારણની પરંદાળી કરવી.

લણણી:

કેલની ખેતીમાં સામાન્ય રીતે લણણી, રોપણીના ૨૦ થી ૨૫ દિવસો પછી શરૂ થાય છે. જે મુખ્યલે જાત આધારિત હોય છે. પહેલી લણણી બાદ ૮ થી ૧૦ દિવસો પછી બીજી લણણી કરી શકાય છે. સારી ગુણવત્તા માટે, કેલના પાંડાની લણણી પાન કોમળ હોય તેવા તબક્કે કરવી. કેલમાં કુલ ૫ થી ૬ લણણી કરવામાં આવે છે, ત્યાર પછી કરવામાં આવતી લણણીમાં પાનની ગુણવત્તા ઘટતી જતી હોય છે.

ઉત્પાદન:

કેલના પાકમાં જાતની વિવિધતા અને ખેતી વ્યવસ્થાપન પદ્ધતિઓના આધારે સરેરાશ ૨૫-૩૦ ટન/હેક્ટર ઉત્પાદ મળી શકે છે.

: વધુ તાંગીક માહિતી/આર્ડરશર્ન માટે :
પ્રો. પ્રિયંકા પટેલ - મો.: ૯૬૮૭૦ ૯૪૪૦ ઈમેલ: priyankapatel@nau.in

કેલની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ



લેખકો

પ્રો. પ્રિયંકા પટેલ,
દુષ્યંત ડિપક્ફુમાર ચાંપાનેરી
અને ડૉ. કેતન ડી. દેસાઈ

પ્રકાશક



બાગાયત પોલિટેકનિક
અસ્પી બાગાયત મહાવિદ્યાલય
નવસારી કૃષિ યુનિવર્સિટી



નવસારી, ગુજરાત – ૩૮૬ ૪૫૦

યુનિ. પ્રકાશન નં.: NAU/02/12/003/2023

વર્ષ : ૨૦૨૩ - ૨૦૨૪